



MONARCH
NETWORK CAPITAL

— wealthcare redefined

15th February, 2021

To
BSE Ltd.
Corporate Relationship Department,
First Floor, New Trading Ring,
Rotunda Building, P. J. Towers,
Dalal Street, Mumbai.

Dear Sir,

Sub: Submission under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Ref: Company Code 511551


With regards to the captioned subject, please find attached herewith copy of e-newspaper of Extract of Un-Audited Standalone & Consolidated Financial Results of the company for the Quarter and Nine months ended 31st December, 2020 which has been published on Saturday, 13th February, 2021 in "Business Standard" and Sunday, 14th February, 2021 in "Gujarat Today".

This is for your information and records pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Thanking you.

Yours faithfully,

For Monarch Network Capital Limited


Ashok Bafna
Whole Time Director
DIN: 01431472



Encl: a/a

Asian Petroproducts and Exports Limited				
Regd. Office: Tundav Rania Road, Nr. Village Anjesar, Tal: Savli, Dist: Vadodara, Gujarat, Website: www.asianpetro.org, Email: barodagroup99@gmail.com. CIN: L23209GJ1991PLC016668				
Unaudited Quarterly Results for the Quarter ended on 31 st December, 2020 (Rs. in Lakhs)				
Sr. No.	Particulars	Quarter ended 31.12.2020 (Unaudited)	Nine Months ended 31.12.2020 (Unaudited)	Quarter ended 31.12.2019 (Unaudited)
1.	Total Income from Operations	6.69	41.57	28.64
2.	Net Profit/(Loss) for the period (before tax, Exceptional Items & or Extraordinary Items)	(6.59)	(18.53)	(5.35)
3.	Net Profit/(Loss) for the period before tax (after exceptional and/or Extraordinary Items)	(6.59)	(18.53)	(5.35)
4.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	(6.59)	(18.53)	(5.35)
5.	Total comprehensive income for the period [comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	(6.59)	(18.53)	(5.35)
6.	Paid up Equity Share Capital	530.00	530.00	530.00
7.	Earning per share	(0.12)	(0.35)	(0.10)
Note: 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange www.bseindia.com and on Company's website www.asianpetro.org. 2. The above Financial Results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind As) specified under Section 133 of the Companies Act, 2013 read with relevant Rules. 3. The above results have been reviewed by Audit Committee of Directors and approved by the Board of Directors at their Meeting held on 12 th February, 2021.				
By the Order of the Board Sd/- Jaykishor Chaturvedi Managing Director				
Date : 12.02.2021 Place : Vadodara				

OFFICE OF THE JOINT CHARITY COMMISSIONER Surat Division, Surat A-Block, 4th Floor, MS Building, Nanpura, Surat-395001		
Scheme Amalgamation Application No.19/2016 Under Section 50-A(2) of the Gujarat Public Trust Act 1950.		
Subject : (1) Mota Varachha Mehfile Islam Trust Trust Reg. No. F/13/Surat. And (2) Mota Varachha Darban Trust Trust Reg. No. E/1334/Surat Amalgamation of all these trust and to frame a scheme for the same.		
Applicants : Shri Kasim Ahmad Bhaiyaat. Other (6) At-251, Voraaji Faliyuu, Mota Varachha, Surat V/S		
Opponent : No		
Whereas the above named applicants have applied to the Joint Charity Commissioner, Surat under Section 50-(A)(2) of the Gujarat Public Trust Act 1950 praying that in the interest of the proper Management and Administration of the above Public Trust, the said Public trusts to be Amalgamated under Section 50-(A)(2) of the Act. A public notice is hereby given that any person interested in the matter may file his written submission on or before 01.09/03/2021 regarding the Amalgamation that whether the above mentioned trust should be amalgamated or Not ? And if amalgamated then in which manner ? If there is any suggestion or objections regarding the amalgamation application and proposed scheme of the above mentioned trusts. Any person who is interested in the trust or who is beneficiary may send their suggestion/objection by post or remain present with objections or suggestions in detail with affidavit on the next hearing of this matter on Office of the Joint Charity Commissioner, A-Block, 4th Floor, MS Building, Nanpura, Surat, either in person or through advocate and they are informed to remain present at 12-30 hrs. on : 24/03/2021 in the office of the Joint Charity Commissioner, Surat. Filing which the matter shall be heard and determined ex/parte and the Joint Charity Commissioner will pass such an orders as deems fit under the Law. Given under my hand and Seal of this Office on : 09/02/2021.		
Prepared by : C. C. Ganvi (Registrar)	Compared by : A. K. Patel (Sr. Clerk)	(R. T. Pandya) Joint Charity Commissioner Surat-Division, Surat.

ADITYA BIRLA FINANCE	
Aditya Birla Housing Finance Limited Registered Office : Indian Rayon Compound, Veraval, Gujarat-362266. Branch Office : *3rd Floor, Office no. 203 to 211, Milestone Fiesta, Near TGB Circle, L. P. Savani Road, Adajan, Surat-395009	
Authorised Officer Mr. Siddharth Kotadia Mobile No. +91 98249 00990 or Mr. Sagar Kotecha Mobile No. +91 99097 99027	
Auction Service Provider (ASP) Chintan Bhatt Mob- 09978591888 / 07968136844.	
APPENDIX- IV-A [See proviso to rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002]	
Sale notice for sale of Immovable properties	
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor i.e. Aditya Birla Housing Finance Limited, the physical possession of which has been taken by the Authorised Officer of Aditya Birla Housing Finance Limited, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 15/03/2021, for recovery of aggregating Rs.23,36,532/- (Rupees Twenty Three Lakhs Thirty Six Thousand Five Hundred Thirty Two Only) for Loan Account No. LNSUR0HL-07180009612 and LNSUR0HL-07180009615 due as on 06/09/2019 plus unchanged interest thereon and expenses due to the Aditya Birla Housing Finance Limited from the Borrowers/Co-Borrowers/Guarantors namely SHARADKUMAR BABUBHAI PIPARIYA, BHAVNABEN BABUBHAI PIPARIYA & DILIPKUMAR B. PIPARIYA. The reserve price will be Rs.19,89,000/- (Rupees Nineteen Lakhs Eighty Nine Thousand Only) and earnest money deposit of Rs.1,98,900/- (Rupees One Lakh Ninety Eight Thousand Nine Hundred Only) for Secured Asset address mentioned below. Property details mentioned herein below :- 1) "ALL THE PART AND PARCEL OF PROPERTY SITUATED ON 'FLAT NO- 202 ,OM PALACE ,BUILDING NO- D , (AS PER PLAN BUILDING NO- C, FLAT NO- 102 AND AS PER SITE BUILDING NO- D, FLAT NO- 202) BLOCK NO. 46/ (PAIKI, D. T. P NO- 45/ (NAVAGAM- VAV) , O. P NO. 28, F. P NO. 28, NR- OM TOWNSHIP, KHVOLAD- KADODARA ROAD, MOJE: NAVAGAM, KAMREJ , Navagam B.O11, SURAT, GUJARAT, INDIA- 394185	
STATUTORY 30 DAYS SALE NOTICE UNDER SARFAESI ACT, 2002. This may also be treated as notice u/r. 8(6) of Security Interest (Enforcement) Rules, 2002 to borrowers/ and guarantors of the above said loan about the holding of E-auction Sale on the above mentioned date. The borrower(s)/ Guarantor(s)/ Mortgagors are hereby noticed to pay the sum mentioned as above within 30 days from the date of publication of this notice failing the property will be auctioned/ sold and balance dues, if any, will be recovered with the interest and cost.	
For detailed terms and conditions of the sale, please refer to the link https://sarfaesi.auctiontigner.net also available at Aditya Birla Housing Finance Limited's website i.e. https://personalfinance.adityabirlacapital.com/properties-for -auction-under-sarfaesi-act.aspx	
Date : 13.02.2021 Place : Surat	
(Authorized Officer) Aditya Birla Housing Finance Limited	

ADITYA BIRLA FINANCE	
Aditya Birla Housing Finance Limited Registered Office : Indian Rayon Compound, Veraval, Gujarat-362266. Branch Office : *3rd Floor, Office no. 203 to 211, Milestone Fiesta, Near TGB Circle, L. P. Savani Road, Adajan, Surat-395009	
Authorised Officer Mr. Siddharth Kotadia Mobile No. +91 98249 00990 or Mr. Sagar Kotecha Mobile No. +91 99097 99027	
Auction Service Provider (ASP) Chintan Bhatt Mob- 09978591888 / 07968136844.	
APPENDIX- IV-A [See proviso to rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002]	
Sale notice for sale of Immovable properties	
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor i.e. Aditya Birla Housing Finance Limited, the physical possession of which has been taken by the Authorised Officer of Aditya Birla Housing Finance Limited, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 16/03/2021, for recovery of aggregating Rs.11,19,066/- (Rupees Eleven Lakhs Nineteen Thousand and Sixty Six Rupees Only) for Loan account No. LNSUR0HL-10180013689 and LNSUR0HL-10180013692 due as on 04/11/2019 plus unchanged interest thereon and expenses due to the Aditya Birla Housing Finance Limited from the Borrowers/Co-Borrowers/Guarantors namely MINABEN PATEEL & NILESH CHHOTU PATEEL. The reserve price will be Rs.12,12,400/- (Rupees Twelve Lakhs Twelve Thousand Four Hundred Only) and earnest money deposit of Rs.1,21,240/- (Rupees One Lakh Twenty-One Thousand and Two Hundred Forty Rupees Only) for Secured Asset address mentioned below. Property details mentioned herein below :- 1) "ALL THE PART AND PARCEL OF THE PROPERTY SITUATED ON PLOT NO-134, AARADHAN PLATINUM, VIBHAG-2, R. S. NO-471, BLOCK NO-463, OPP- PAPER MILL, NR- GANGADHARA RAILWAY STATION, UMRRAKH, BARDOLI, SURAT, Bardoli H.O, SURAT, GUJARAT, INDIA- 394601"	
STATUTORY 30 DAYS SALE NOTICE UNDER SARFAESI ACT, 2002. This may also be treated as notice u/r. 8(6) of Security Interest (Enforcement) Rules, 2002 to borrowers/ and guarantors of the above said loan about the holding of E-auction Sale on the above mentioned date. The borrower(s)/ Guarantor(s)/ Mortgagors are hereby noticed to pay the sum mentioned as above within 30 days from the date of publication of this notice failing the property will be auctioned/ sold and balance dues, if any, will be recovered with the interest and cost.	
For detailed terms and conditions of the sale, please refer to the link https://sarfaesi.auctiontigner.net also available at Aditya Birla Housing Finance Limited's website i.e. https://personalfinance.adityabirlacapital.com/properties-for -auction-under-sarfaesi-act.aspx	
Date : 13.02.2021 Place : Surat	
(Authorized Officer) Aditya Birla Housing Finance Limited	

HARISH TEXTILE ENGINEERS LIMITED							
Regd. Office: 2nd Floor, 19, Parsi Panchayat Road, Andheri (East), Mumbai - 400 069. Phone: +91 22 28367151 / 40373000, website: www.harishtextile.com; E Mail : investor@harishtextile.comCIN: U29119MH2010PLC201521							
Extract of Unaudited Standalone Financial Results for the Quarter Ended December 31, 2020 (Rs. in Lakhs)							
Sr. No.	Particulars	Quarter ended December 31, 2020 (Unaudited)	Quarter ended September 30, 2020 (Unaudited)	Quarter ended December 31, 2019 (Unaudited)	Nine-month Ended December 31, 2020 (Unaudited)	Nine-Month Ended December 31, 2019 (Unaudited)	Year ended March 31, 2020 (Audited)
1.	Total Income from Operations	2,522.80	1,918.19	2,325.12	4,994.66	6,180.29	8,363.59
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	276.25	85.32	23.62	208.79	131.03	(53.07)
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	276.25	85.32	23.62	208.79	131.03	(53.07)
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	225.77	92.16	23.62	162.07	96.55	(72.77)
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	225.77	92.16	23.62	162.07	96.55	(72.77)
6.	Equity Share Capital	33.36	33.36	33.36	33.36	33.36	33.36
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year						399.59
8.	Earnings Per Share (of Rs. 10/- each) (not annualised)						
1. Basic		6.77	2.76	0.71	4.86	2.89	(2.18)
2. Diluted		6.77	2.76	0.71	4.86	2.89	(2.18)
Note: The above is an extract of the detailed format of Unaudited Standalone Financial Results for the Quarter Ended on December 31, 2020 filed with the Stock Exchange on 12th February, 2021 under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the quarter and nine months ended on 31st December, 2020 are available on the Company's website www.harishtextile.com and on the Stock Exchange website www.bseindia.com							
For Harish Textile Engineers Ltd. for and on behalf of the Board of Directors Sd/- Sandeep Desai Managing Director DIN: 00941665							
Place: Mumbai Date: 12/02/2021							

AMBITION MICA LIMITED							
CIN: L25202GJ2010PLC059931 Shop No. 28, 1st Floor, Vitthal Plaza, Opp. Naroda GEB, Off. Dehgam Road, Nava Naroda, Ahmedabad-382330 Phone: 079- 29292629 Website: www.ambitionmica.com, Email: investor@ambitionmica.com							
Extract of Un-audited (Standalone) Financial Results for the quarter and nine months ended on 31st December, 2020 (Rs. in Lacs)							
Sr. No.	Particulars	Quarter Ended 31-12-2020 Unaudited	Quarter Ended 30.09.2020 Unaudited	Quarter Ended 31-12-2019 Unaudited	Nine Months Ended 31-12-2020 Unaudited	Nine Months Ended 31-12-2019 Unaudited	Year Ended 31.03.2020 Audited
1	Income from Operations	1099.63	915.58	1570.58	2316.85	4990.07	6392.01
2	Profit/(Loss) for the period (before Tax and exceptional items)	(98.31)	(417.36)	50.49	(577.58)	(196.27)	11.59
3	Profit/(Loss) for the period (before Tax and after exceptional items)	(98.31)	(417.36)	50.49	(577.58)	(196.27)	11.59
4	Net Profit/(Loss) for the period (after Tax and exceptional items)	(102.69)	(421.48)	46.26	(589.46)	(210.31)	97.56
5	Paid-up equity share capital (Face value of Rs. 10/- per share)	1492.20	1492.20	1492.20	1492.20	1492.20	1492.20
6	Reserves (excluding revaluation reserves)	962.36	1064.88	1241.36	962.36	1241.36	1549.46
7	Earnings per Share						
-Basic		-0.69	-2.82	0.31	-3.95	-1.41	0.66
-Diluted		-0.69	-2.82	0.31	-3.95	-1.41	0.66
Notes: The above is an extract of the detailed format Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Quarterly Financial Results are available on the Stock Exchanges website at www.bseindia.com, and also on the Company's website at www.ambitionmica.com.							
Govindbhai V. Patel Sd/- Managing Director DIN:02927165							
Place: Ahmedabad Date: 12.02.2021							

MONARCH
NETWORK CAPITAL
enriching value

MONARCH NETWORK CAPITAL LIMITED

CIN: L65920GJ1993PLC120014

Corporate Office : 901/902, Atlanta Centre, Goregaon (E), Mumbai-400063

Tel No. 022-4321 1800; Email: cs@mncdgroup.com; Website: www.mncdgroup.com

EXTRACT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2020

(Rs. in Lacs except EPS)

Sr. No.	Particulars	Standalone	Consolidated				
		Quarter ended 31.12.2020	Year ended on 31.03.2020	Quarter ended 31.12.2019	Quarter ended 31.12.2020	Year ended on 31.03.2020	Quarter ended 31.12.2019
		Un-Audited	Audited	Un-Audited	Un-Audited	Audited	Un-Audited
1	Total Income from operations (Net)	1,671.04	5,461.00	1,181.25	1,767.56	6,488.89	1,407.47
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and /or Extraordinary items)	337.08	221.86	(15.88)	368.02	356.95	(4.29)
3	Net Profit / (Loss) for the period before tax (After Exceptional and /or Extraordinary items)	336.98	216.75	(15.89)	367.92	351.85	(4.29)
4	Net Profit / (Loss) for the period after tax (After Exceptional and /or Extraordinary items)	266.26	122.97	(21.99)	296.41	225.05	(17.16)
5	Total Comprehensive Income for the period [Comprising profit/loss for the period (after tax) and other comprehensive Income (after tax)]	277.46	88.77	(22.57)	307.61	190.94	(17.70)
6	Paid up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	3,104.95	3,104.95	3,104.95	3,104.95	3,104.95	3,104.95
7	Earnings per Equity Share in Rs. 10/- each (not annualised)						
i	Basic & Diluted (Before extra-ordinary items)	0.89	0.29	(0.07)	0.99	0.61	(0.06)
ii	Basic & Diluted (After extra-ordinary items)	0.89	0.29	(0.07)	0.99	0.61	(0.06)

Note: The above is an extract of the detailed format of Quarterly Un-Audited Financial Results filed with Bombay Stock Exchange Limited under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the following websites:

- 1) On the BSE Limited: <https://beta.bseindia.com/stock-share-price/monarch-network-capital-ltd/monarch/511551/>
- 2) On Company's website: <https://www.mncdgroup.com/investor-relation/investor-relation-financials-quarterly-results>

**By order of the Board of Directors
For Monarch Network Capital Limited**

**sd/-
Vaibhav Shah
Managing Director**

**Date : 12th February, 2021
Place : Mumbai**

MUKAT PIPES LIMITED							
Registered Office: Flat No. 39, Parag Apartments, 7th Floor, J.P. Road, Versova, Andheri (West), Mumbai 400061. CIN: L27200MH1987PLC044407 Website: www.mukatpipes.com e-mail: mukatpipes@gmail.com Tel: 01762-225040, Fax: 01762-222390							
EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31.12.2020 (Rs. In Lacs)							
Particulars	Quarter ended 31.12.2020 (Unaudited)	30.09.2020 (Unaudited)	31.12.2019 (Unaudited)	31.12.2020 (Unaudited)	31.12.2019 (Unaudited)	31-03-2020 (Audited)	
Total income from operations (net)	198.10	197.54	62.27	408.16	405.45	447.71	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(5.21)	17.82	(10.78)	(10.36)	9.89	(4.82)	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(5.21)	17.82	(10.78)	(10.36)	9.89	(4.82)	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(5.21)	17.82	(10.78)	(10.36)	9.89	(4.82)	
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(5.21)	17.82	(10.78)	(10.36)	9.89	(4.82)	
Equity Share Capital (Face Value Rs.5/- per Share)	591.50	591.50	591.50	591.50	591.50	591.50	
Reserves (excluding Revaluation Reserve)	-	-	-	-	-	(1264.28)	
Earnings Per Share (before extraordinary items) (Face Value Rs. 5/- each)							
Basic :	(0.04)	0.15	(0.09)	(0.09)	0.08	(0.04)	
Diluted:	(0.04)	0.15	(0.09)	(0.09)	0.08	(0.04)	
Notes: 1) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Company's website www.mukatpipes.com and on the website of BSE i.e. www.bseindia.com 2) The unaudited Financial Results for the quarter and nine months ended on 31.12.2020 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on 12.02.2021. 3) # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.							
For MUKAT PIPES LIMITED Sd/- (RUPINDER SINGH AHLUWALIA) CHAIRMAN DIN - 01239483							
Date: 12.02.2021 Place: Rajpura							

OMKAR PHARMACHEM LIMITED			
Regd. Off. 501, Mahakant Building, Opp: V.S. Hospital, Ashram Road, Ellisbridge, Ahmedabad-380006. Ph.079-26580892 CIN: L930006J1995PLC025276, Website: www.omkarpharmachem.co.in, Email: investors.opi@gmail.com			
Extract of the Standalone Unaudited Financial Results for the Quarter and Nine Months ended 31st December, 2020			
(Rs. in lakh except per share data)			
Particulars	Quarter Ended 31.12.2020	Nine Months Ended 31.12.2020	Quarter Ended 31.12.2019
Total income from Operations (Net)	4.50	13.50	0.00
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	(2.06)	(6.27)	(5.08)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	(2.06)	(6.27)	(5.08)
Net Profit(Loss)for period after tax (after Exceptional items)	(2.06)	(6.27)	(5.08)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(2.06)	(6.27)	(5.08)
Equity Share Capital (Face Value Rs. 10/-each)	1008.37	1008.37	1008.37
Reserves excluding Revaluation Reserves as on 31st March	(164.23)	(164.23)	(138.27)
Earning Per Share(before & after extraordinary items)(of Rs. 10 each)			
Basic and diluted Rs.	(0.0204)	(0.0622)	(0.0504)
Note			
1) The above is an extract of the detailed format of Quarter and Nine Months Ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter and Nine Months ended Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and on the Company's website www.omkarpharmachem.co.in			
2) The above results have been reviewed by the audit committee & approved by the Board of Directors at their respective meetings held on 12th February, 2021.			
By order of the Board For, Omkar Pharmachem Limited Sd/- Bhawani Shankar Goyal Managing Director DIN: 03255804			
Address: H No. 77, Nangal Chaudhary Teh. Narnaul, Dist. Mahendergarh Nangal, Chaudhary 123023 HR			
Date : 12.02.2021 Place : Ahmedabad			

BHANDRI INFRACON LIMITED						
Regd. Office : B/72, Jabuka Complex, Nr. Bejrang Ashram, Below Vikas School, Nh-8, Thakkerbapanager, Ahmedabad-382350 (CIN: L45201GJ2004PLC044481)						
EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2020						
PART I		(Rs. in Lacs)				
SR. NO.	PARTICULARS	Half Year Ended		Year Ended		
		Unaudited 30-Sep-20	Audited 31-Mar-20	Unaudited 30-Sep-19	Audited 31-Mar-20	
1	Total Income from Operation	221.32	406.43	220.25	626.69	
2	Net Profit for the Period (before Tax, Exceptional Items and / or Extraordinary Items)	(122.02)	30.14	4.30	34.44	
3	Net Profit / (Loss) for the Period (before Tax but after Exceptional Items and / or Extraordinary Items)	(122.02)	30.14	4.30	34.44	
4	Net Profit / (Loss) for the period after tax	(122.69)	20.73	3.04	23.77	
5	Minority Interest	(34.15)	1.63	(0.15)	1.48	
6	Paid-up Equity Share Capital (Face Value Rs.10/-)	259.66	259.66	259.66	259.66	
7	Earning per share (of Rs. 10/- each) (not annualised)					
a) Basic		(3.53)	0.74	0.12	0.06	
b) Diluted		(3.53)	0.74	0.12	0.06	

Notes :

- The above Un-Audited results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on 12th February, 2021 by the Auditors of the company, in accordance with SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015.
- The Statutory Auditors of the Company have issued an modified report.
- Key data relating to standalone unaudited financial results of Bhandri Infracon Limited is as under:

SR. NO.	PARTICULARS	Half Year Ended		Year Ended	
		Unaudited 30-Sep-20	Audited 31-Mar-20	Unaudited 30-Sep-19	Audited 31-Mar-20
1	Total Income from Operation	162.32	334.40	220.24	554.84
2	Profit from ordinary activities before tax	14.57	23.49	4.86	28.35
3	Tax expenses /(Credit)	3.67	9.24	1.26	10.50
4	Net profit after tax	10.90	14.25	3.60	17.85

4. The above is an extract of the detailed format of half yearly results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the half year financial results are available on the Stock Exchanges websites i.e. www.bseindia.com

For & on behalf of the Board of Directors
Sd/-
Bhramkaben Sunilbhai Patel
Director

Mumbai, 12.02.2021